

તા. ૩૧-૧૨-૨૦૧૭ના રોજનું પાકુ સરવૈયું

મૂડી-દેવાં	રકમ (રૂ.)	મિલકત-લેણાં	રકમ (રૂ.)
મૂડી:		સ્થિર મિલકતો	૧૫૦૦૦૦
ઉધા - ૫૫૦૦૦		સ્ટોક	૧૮૦૦૦
ત્રિશા - ૨૫૫૦૦		રોકડ	૧૫૦૦૦
વિશ્વાસ - ૨૦૦૦૦	૧૦૦૫૦૦		
નફા-નુકશાન ખાતુ	૩૫૦૦૦		
ત્રિશાની લોન	૧૭૫૦૦		
બેંક લોન	૧૦૦૦૦		
લેણદારો	૨૦૦૦૦		
	૧૮૩૦૦૦		૧૮૩૦૦૦

મિલકતોના નીચે પ્રમાણે હતામાં ઉપજ્યા:

હામા	રકમ (રૂ.)
૧	૨૫૦૦૦
૨	૩૫૦૦૦
૩	૨૩૦૦૦
૪	૧૮૦૦૦

વિસર્જન ખર્ચ અનામત પેટે રૂ. ૩૦૦૦ અલગ રાખો, જે ખરેખર થયો અને ચૂકવ્યો.

મૂડી વધારાની પદ્ધતિએ ભાગીદારો વચ્ચે રોકડની હમે-હમે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો.

અથવા

પ્ર.૪

- (અ) રાહી, દિયા અને નીના ૩:૨:૧ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચતા ભાગીદારો છે. તેઓએ તા. ૩૧-૧૨-૨૦૧૭ (૧૦) ના રોજ પેઢીનું વિસર્જન કરવાનું નક્કી કર્યું. તે તારીખે પેઢીનું પાકુ સરવૈયું નીચે પ્રમાણે હતું.

તા. ૩૧-૧૨-૨૦૧૭ના રોજનું પાકુ સરવૈયું

મૂડી-દેવાં	રકમ (રૂ.)	મિલકત-લેણાં	રકમ (રૂ.)
મૂડી:		સ્થિર મિલકતો	૬૫૦૦૦
રાહી - ૨૦૦૦૦		ચાલુ મિલકતો	૩૫૦૦૦
દિયા - ૮૦૦૦		રોકડ	૪૦૦૦
નીના - ૧૨૦૦૦	૪૦૦૦૦		
નફા-નુકશાન ખાતુ	૧૨૦૦૦		
દિયાની લોન	૨૦૦૦૦		
લેણદારો	૩૨૦૦૦		
	૧૦૪૦૦૦		૧૦૪૦૦૦

મિલકતોના નીચે પ્રમાણે હતામાં મળ્યા

હામા	રકમ (રૂ.)
૧	૩૬૦૦૦
૨	૨૬૦૦૦
૩	૨૨૨૦૦

તેઓએ વિસર્જન ખર્ચ અનામત તરીકે રૂ. ૪૦૦૦ રાખવાનું નક્કી કર્યું. ખરેખર વિસર્જન ખર્ચ રૂ. ૨૨૨૦૦ થયો.

‘મહત્તમ નુકશાનની પદ્ધતિ’એ ભાગીદારો વચ્ચે રોકડની ટુકડે-ટુકડે વહેંચણી દર્શાવતું પત્રક તૈયાર કરો.

- (બ) ‘મહત્તમ નુકશાન’ની પદ્ધતિ પર નોંધ લખો.

(૦૫)